



ફિક્સ થાળી

કલાસિક ફિક્સ થાળી (૨-ગુલાબ જાંબુ, ૨૨૫ ગ્રામ વેજ. અથવા પનીર સબ્જી, ૩ ધી ફુલકા રોટલી, ૨૫૦ ગ્રામ ભાત, ૨૨૫ ગ્રામ દાળ, ૧ સેકેલો પાપડ, છાસ ૨૦૦ મીલી, અથાણુ, કુંગણી)	186/-
પેરેડાઈસ ફિક્સ થાળી (૨-ગુલાબ જાંબુ, ૨૨૫ ગ્રામ વેજ. સબ્જી, ૨૨૫ ગ્રામ પનીર સબ્જી, ૪ ધી ફુલકા રોટલી, ૨૫૦ ગ્રામ ભાત, ૨૨૫ ગ્રામ દાળ, ૧ સેકેલો પાપડ, છાસ ૨૦૦ મીલી, અથાણુ, કુંગણી)	222/-

પસંદગીવાળુ મીલ (થાળી)

બીરયાની મીલ અને ૨૦૦ ગ્રામ રાયતુ	
વેજ. બીરીયાની	191/-
દેહાબાદી બીરીયાની	201/-
લઝીઝ બીરીયાની	221/-
શેફ રપે. બીરીયાની	241/-
પુલાવ અને ૨૦૦ ગ્રામ રાયતુ	
આલુ મટર પુલાવ	141/-
વેજ. પુલાવ	161/-
પનીર પુલાવ	191/-
કાજુ પનીર પુલાવ	241/-
ખીચડી અને ૨૦૦ મીલી. છાસ	
દાલ મસાલા	151/-
દાલ પાલક	161/-
કોર્ન પાલક	161/-
તડકા વાળી	181/-

ટેસ્ટ ઓફ ગુજરાત

સેવ ટામેટા (૪૦૦ ગ્રામ)	141/-
ચા અને કોફી	
ચા	46/-
કોફી	56/-

ટેસ્ટ ઓફ મસાલા (સબ્જી)

	Plate 350gm	1 Kg
મીક્સ વેજીટેબલ ગ્રેવી	151/-	421/-
ચના મસાલા	151/-	421/-
આલુ પાલક (ગ્રીન)	151/-	421/-
વેજ. અને મખાના મસાલા	151/-	421/-
આલુ મટર મસાલા	151/-	421/-
આલુ ગોબી ગ્રેવી	151/-	421/-
જીરા આલુ ગ્રેવી	151/-	421/-
જીરા આલુ ફ્રાય	151/-	421/-
વેજ. કોલ્હાપુરી (તીખુ)	151/-	421/-
વેજ. તુફાની (તીખુ)	151/-	421/-
વેજ. જયપુરી	151/-	421/-
આલુ ગોબી ફ્રાય	171/-	451/-
મશરૂમ મસાલા	171/-	481/-
વેજ. કડાઈ	181/-	491/-
મીક્સ વેજીટેબલ ફ્રાય	191/-	511/-
પનીર ટિકકા મસાલા	191/-	511/-
પાલક પનીર (ગ્રીન)	191/-	511/-
પનીર બેબી કોર્ન	191/-	511/-
પનીર કોર્ન મસાલા	191/-	511/-
પનીર કાલી મિર્ચ	191/-	511/-
પેરી પેરી પનીર મસાલા	191/-	511/-
પનીર તુફાની (તીખુ)	191/-	511/-
મશરૂમ કીમા	201/-	541/-
પનીર ભૂઈ	201/-	541/-
પનીર બટર મસાલા	201/-	541/-
પાનીર કડાઈ	201/-	541/-
પનીર મશરૂમ મસાલા	201/-	541/-
પનીર હાંડી	222/-	601/-
પનીર મખની	222/-	601/-
કાજુ બટર મસાલા	222/-	601/-
કાજુ પનીર મસાલા	222/-	601/-
શાહી પનીર (સ્વીટ)	222/-	601/-
ચીઝી પનીર ભૂઈ	222/-	601/-
કાજુ કરી (તીખુ)	222/-	601/-
ચીઝ બટર મસાલા	222/-	601/-
શેફ રપે.સબ્જી	251/-	651/-



સ્ટાર્ટર

મન્યુરિયન ફ્રાય	181/-
મન્યુરિયન ગ્રેવી	191/-
હની ચીલી પોટેટો	201/-
પનીર કપ	251/-
પનીર ચીલી ફ્રાય	251/-
મશરૂમ કપ	251/-
ટેરિયાકી પનીર (તીખુ)	251/-

ફાઈડ રાઈસ

વેજ. ફાઈડ રાઈસ	161/-
મન્યુરિયન ફાઈડ રાઈસ	181/-
સેઝવાન ફાઈડ રાઈસ (તીખુ)	181/-
મેક્સિકન ફાઈડ રાઈસ	199/-
ટેરિયાકી ફાઈડ રાઈસ (તીખુ)	199/-
પનીર ફાઈડ રાઈસ	222/-
મશરૂમ ફાઈડ રાઈસ	222/-

Call Us : 74348 00090
63598 00090

Follow us on

f maakakitchen.official
@ maakakitchen2023

સારી સુવિધા માટે નિયમોનું પાલન કરવું જરૂરી

- (૧) જે આઈટમ હાજર માં હશે તે મળશે.
- (૨) એક વખત ઓર્ડર આપ્યા બાદ ઓર્ડર કેન્સલ થશે નહીં.
- (૩) તાજુ અને સાફ ફુડ મેળવવા માટે ૪૦ મીનીટનો સમય લાગશે.
- (૪) રૂ. ૪૯૯ થી વધુ રકમ પર ફ્રી ડીલિવરી મળશે (૫ કી.મી. મર્યાદામાં).
- (૫) પેકીંગ ચાર્જ એક્સ્ટ્રા લેવામાં આવશે.
- (૬) કાયદાકીય કાર્યવાહી વડોદરા કોર્ટને આધીન રહેશે.
- (૭) બધા પ્લેટના વજન અંદાજિત રહેશે.



સવારે ૯ થી રાત્રે ૧૧



www.maakakitchen.co.in



MENU
આપના
ખોરાક
પ્રત્યેની
કાળજી
તે અમારો
મુખ્ય ધ્યેય છે



પાર્ટી ઓર્ડર આવકાર્ય

સવારે નાસ્તો (સવારે ૯ થી બપોરે ૧૨.૩૦)

સિંઘી કાંદા કોડી (૧નંગ)	71/-
ઈન્દોરી પોવા (લાઈટ સ્વીટ)(૨૭૫ ગ્રામ)	77/-
બટેટા પોવા (તીખુ) (૨૭૫ ગ્રામ)	77/-
વેજ. ઉપમા (સફેદ)(૩૫૦ ગ્રામ)	77/-
સિંઘી સત્રા પકોડા (૬નંગ)	81/-
પૂરી શાક (લાઈટ સ્વીટ)	111/-
(૨૨૫ ગ્રામ બટેટા શાક, ૫ નંગ પુરી, ડુંગળી, અથાણુ, છાસ ૨૦૦ મીલી)	
આલુ પરોઠા સાથે ૨૨૫ ગ્રામ દહીં	121/-
(૧ નંગ આલુ પરોઠા, ૨૨૫ ગ્રામ દહીં)	
થેપલા સુકી ભાજી	121/-
(૨૨૫ ગ્રામ બટેટા સુકીભાજી, ૩ નંગ થેપલા, ડુંગળી, અથાણુ, છાસ ૨૦૦ મીલી)	
સિંઘી દાળપૂરી	121/-
(૨૨૫ ગ્રામ સિંઘી દાળ, ૫ નંગ પુરી, ચટણી, ડુંગળી, અથાણુ, તળેલુ મરચુ, છાસ ૨૦૦ મીલી)	

કુલકા રોટલી

કુલકા રોટલી (પ્લેન)	15/-
કુલકા રોટલી (ઘી)	20/-
કુલકા રોટલી (માખણ)	25/-

હળવો નાસ્તો

ફેન્ય ફાઈસ	71/-	101/-
પેરી પેરી ફાઈસ	81/-	111/-
છોટુ ફાઈસ	51/-	-

થેપલા

કોથમીર થેપલા	125/-
મેથી થેપલા	125/-
દૂધી થેપલા	125/-



દાળ પકવાન

રેગ્યુલર દાળ પકવાન (૨ પકવાન, ૨૨૫ ગ્રામ દાળ, છાશ ૨૦૦મીલી, ડુંગળી, ચટણી, તળેલુ મરચુ, અથાણુ)	81/-
દાળ પકવાન ૨.૦ (૨ પકવાન, ૩૨૫ ગ્રામ દાળ, છાશ ૨૦૦મીલી, ડુંગળી, ચટણી, તળેલુ મરચુ, અથાણુ)	101/-
તડકા દાળ પકવાન (૪ પકવાન, ૪૫૦ ગ્રામ દાળ, છાશ ૨૦૦મીલી, ડુંગળી, ચટણી, તળેલુ મરચુ, અથાણુ)	151/-
એકરટ્ટા દાળ (૨૨૫ ગ્રામ)	41/-
એકરટ્ટા તડકા દાળ (૪૫૦ ગ્રામ)	71/-
પકવાન (૧ પીસ)	20/-

જમવા સાથે

સેકેલો પાપડ	15/-
તળેલો પાપડ	25/-
છાસ	22/-
દહીં (૨૨૫ ગ્રામ)	66/-
ગ્રીન સલાડ	77/-
ખારી લરસી (૩૦૦ મીલી)	77/-
બુંદી રાયતું (૨૨૫ ગ્રામ)	77/-
મીઠી લરસી (૩૦૦ મીલી)	88/-

ખીચડી

દાલ મસાલા ખીચડી	161/-	481/-
દાલ પાલક ખીચડી	171/-	501/-
કોર્ન પાલક ખીચડી	171/-	501/-
તડકે વાલી ખીચડી	191/-	551/-

દાળ

દાળ ફાચ	136/-	391/-
દાળ તડકા (તીખુ)	151/-	411/-
દાળ મખની	181/-	501/-
રાજમા	181/-	501/-

ચાવલ

પ્લેન રાઈસ (સ્ટીમ)	111/-	351/-
જીરા રાઈસ	136/-	391/-

બિરયાની

વેજ બિરયાની	201/-	501/-
હેંદરાબાદી બિરયાની (ગ્રીન) (તીખુ)	222/-	551/-
લઝીઝ પનીર બિરયાની	251/-	601/-
શેફ્ટ સ્પે. બિરયાની	251/-	601/-

પુલાવ

આલુ મટર પુલાવ	151/-	401/-
વેજ.પુલાવ	171/-	451/-
પનીર પુલાવ	201/-	501/-
કાજુ પનીર પુલાવ	251/-	601/-

ઉનાળા સ્પેશ્યલ (સિઝનલ)

આમ પત્રા (૨૦૦ મીલી)	21/-
હાફૂસ આમ રસ (૩૦૦ ગ્રામ)	151/-
હાફૂસ આમ રસ અને પુરી (૩૦૦ ગ્રામ આમરસ, ૫ નંગ પુરી)	181/-

સ્ટીમ મોમોસ (5 Pcs.)

વેજ. મોમોસ	66/-
વેજ.ચીઝ મોમાસ	99/-
પનીર મોમોસ	99/-
ચીઝી પાલક મોમોસ	99/-
મિક્સ મોમોસ	111/-
વેજ.ચીઝ કોર્ન મોમોસ	121/-



મિલ્સ (નાની થાળી)

દહીં ચાવલ મીલ	121/-
(૨૨૫ ગ્રામ દહીં, ૨૫૦ ગ્રામ ભાત)	
દાલ ચાવલ મીલ (૨૨૫ ગ્રામ દાલફાચ, ૨૫૦ ગ્રામ ભાત, ૨૦૦ મીલી છાશ, ડુંગળી, અથાણુ)	131/-
દાલ રોટલી મીલ (૨૨૫ ગ્રામ દાલફાચ, ૪ ઘી કુલકા રોટલી, ૨૦૦ મીલી છાશ, ડુંગળી, અથાણુ)	131/-
સેવ ટામેટા મીલ (તીખુ)	131/-
(૨૨૫ ગ્રામ સેવટમેટા શાક, ૪ ઘી કુલકા રોટલી, ૨૦૦ મીલી છાશ, ડુંગળી, અથાણુ)	
વેજ. સબ્જી મીલ	131/-
(૨૨૫ ગ્રામ વેજ. શાક, ૪ ઘી કુલકા રોટલી, ૨૦૦ મીલી છાશ, ડુંગળી, અથાણુ)	
પનીર સબ્જી મીલ	151/-
(૨૨૫ ગ્રામ પનીર શાક, ૪ ઘી કુલકા રોટલી, ૨૦૦ મીલી છાશ, ડુંગળી, અથાણુ)	
છોલે ભટ્ટુરે મીલ (૨૨૫ ગ્રામ છોલે, ૩ ભટ્ટુરે, ૨૦૦ મીલી છાશ, ડુંગળી, અથાણુ)	151/-
છોલે ચાવલ મીલ (૨૨૫ ગ્રામ છોલે, ૨૫૦ ગ્રામ ભાત, ૨૦૦ મીલી છાશ, ડુંગળી, અથાણુ)	151/-
રાજમા ચાવલ મીલ (૨૨૫ ગ્રામ રાજમા, ૨૫૦ ગ્રામ ભાત, ૨૦૦ મીલી છાશ, ડુંગળી, અથાણુ)	161/-
દાલ મખની મીલ	161/-
(૨૨૫ ગ્રામ દાલ મખની, ૨૫૦ ગ્રામ ભાત, ૨૦૦ મીલી છાશ, ડુંગળી, અથાણુ)	
પાસ્તા	
ચિદ્દી પાસ્તા (તીખુ)	141/-
ટોમાટીના પાસ્તા	141/-
સેજવાન પાસ્તા (તીખુ)	141/-
મેક્સિકન પાસ્તા	171/-
ઈટાલિયન પાસ્તા	171/-
ટેરિયાકી પાસ્તા (તીખુ)	171/-
સ્વીટ કીમી પાસ્તા	181/-
વ્હાઈટ સોસ પાસ્તા	181/-

